



## ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા

ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી, ગોધરા ખાતે **"Basics of Statistical and Mathematical Modeling using Origin Professional 2020 software"** વિષય પર તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામા આવ્યો.

**"Origin Professional 2020 software"** ની આંકડાકીય અને ગાણિતિક વિશ્લેષણ અને ગ્રાફિકલ પ્રસ્તુતિની ક્ષમતાઓને દયાને લઈ ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા ખાતે **"Basics of Statistical and Mathematical Modeling using Origin Professional 2020 software"** વિષય અંતર્ગત આચાર્ય અને ડીનશ્રી, ડો. આર. સુબેયાની અધ્યક્ષતામા તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામા આવ્યો.

ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગના વડાશ્રી. ડો. એમ. કે. તિવારીએ સર્વે આમંત્રિત મહેમાનોને શાબ્દિક પ્રવચન અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમના અધક્ષ સ્થાનેથી ડો. આર. સુબેયા, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઈજનેરી, ગોધરાએ સદરહુ સોફ્ટવેરની જરૂરીયાતો, મેથેમેટિકલ મોડેલિંગ, તકનીકો અને સોફ્ટવેરની સમજણથી જરૂરીયાતો, મહત્વ અને તકો પર પ્રકાશ પાડ્યો હતો.

સદર તાલીમ કાર્યક્રમમા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરાના ફેકલ્ટી, સ્ટાફ તેમજ અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમ કુલ ૪૦ લોકોએ ભાગ લીધો. પ્રોસેસિંગ અને ફુડ ઈજનેરી વિભાગના સહ પ્રાધ્યાપક અને વડા, શ્રી નવનીત કુમારે **"Mathematical Modelling in Agricultural Processing using Origin Pro. 2020"** વિષય પર તેમજ ઈરિગેશન, ડ્રેનેજ ઈજનેરી વિભાગના વડાશ્રી. ડો. એમ. કે. તિવારીએ **"Hydrological Modelling using Origin Pro, 2020"** વિષય પર લેક્ચર/ હેડ્સ ઓન તાલીમ આપી તેમજ કોણાર્ક સોલ્યુશન પ્રા.લી. ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી. કૃણાલ ત્રિવેદીએ ટેકનીકલ એક્સપર્ટ અને ગેસ્ટ લેક્ચરર તરીકે કેટલાક ડેટાસેટના ઉદાહરણોનો ઉપયોગ કરી વિવિધ આંકડાકીય અને ગાણિતિક વિશ્લેષણ અને ગ્રાફિકલ પ્રસ્તુતિની ક્ષમતાઓની તકનીકી તાલીમ આપી.

ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરાના ઈજ. એસ.જે.પારગી, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ શ્રી. એ.કે. બામણીયા, લેબ. ટેકનિશિયને સમગ્ર તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારનો તકનીકી સહયોગ આપ્યો. તકનીકી તાલીમ દરમિયાન ફેકલ્ટી, સ્ટાફ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ પુછેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામા આવ્યું. કાર્યક્રમના અંતમા ઈરિગેશન અને ડ્રેનેજ ઈજનેરી વિભાગના વડાશ્રી. ડો. એમ. કે. તિવારીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

